

BHATIA COMMUNICATIONS & RETAIL (INDIA) LIMITED

BHATIA'S[®]
The mobile one stop shop

CIN: L32109GJ2008PLC053336

Regd Off: 132, Dr. Ambedkar Shopping Centre, Ring Road, Surat-395002
Email: info@bhatiamobile.com, Ph: 0261-2349892
Website : www.bhatiamobile.com

Date: 31/05/2023

To,
BSE Limited
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street,
Mumbai- 400001

Scrip Code : BHATIA /540956

Subject : Intimation of Newspaper Advertisement of Extract of Standalone Audited Financial Results for the Quarter and Year Ended 31st March, 2023

Reference No. : Regulation 47 and 30 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

Dear Sir/Madam,

We wish to inform that pursuant to Regulation 47 and 30 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we enclose herewith copies of Extract of Audited Financial Result for the Quarter and Year ended on 31st March, 2023 published in Newspapers on Wednesday, 31st May, 2023.

1. English Daily: "Free Press Gujarat" dated 31st May, 2023.
2. Regional Language Daily: "Lokmitra" dated 31st May, 2023.

You are requested to kindly take the same on record.

Yours Faithfully,

Thanking you
For Bhatia Communications & Retail (India) Limited


Sanjeev Harbanslal Bhatia
Managing Director
DIN: 02063671

Place: Surat

Encl: Copy of Newspaper

State aims to contribute 10% to country's economy: CM '10k villages getting Narmada water' Amid sanctions, import of Russian rough diamonds up



GANDHINAGAR: Presenting Gujarat's development vision at the eighth governing council meeting of Niti Aayog in Delhi on Saturday, chief minister Bhupendra Patel said Gujarat has set a target of contributing more than 10% of the country's economy in the next few years.

Highlighting the state's focus on achieving green growth with renewable energy (RE), Patel said Gujarat's renewable energy capacity has reached 20 gigawatts (GW), which is 15% of India's RE capacity. He added that the

government has drawn up an ambitious green hydrogen generation plan and aims to generate 100GW of RE in the near future.

"The PM has set a vision to make India a \$5 trillion economy in the coming years. Gujarat, in line with the PM's vision, has set a target to contribute 10% or more to the national economy," an official statement quoted the CM as saying at the Niti Aayog governing council meeting.

Patel said Gujarat is the first state in the country to integrate Union and state data layers into the integrated PM

Gati Shakti portal. "Due to this, it now takes less time for project planning. PM Gati Shakti is also being leveraged across sectors like socio-infrastructure development, schools, community health centres, gram panchayat bhavans and the like," he said.

Presenting the state's achievements in various fields, Patel said Gujarat has been a preferred destination for investment for the past two decades. He added that successive editions of the Vibrant Gujarat Global Summit (VGGGS) laid a strong foundation for increasing investments in the state. The 10th edition of the VGGGS will be held in Gandhinagar in January next year.

Asserting that MSMEs are the backbone of Gujarat's economy, Patel said more than 12 lakh MSME units are registered on the state's MSME portal. These units have received investments of Rs 63,000 crore and about 75 lakh persons have been employed by these MSMEs.



GANDHINAGAR: According to the state government, more than 10,000 villages in the state are receiving water through the Narmada canal network and 4,000 others villages have been receiving surface water and water from other sources. There are more than 18,000 villages in the state.

Stating that there is adequate water in reservoirs to provide drinking water to the people, a statement from the state government said arrangements have been made to dig new borewells at some places while water tankers have been pressed into service to provide drinking water to villages in coastal districts.

The statement said that while 2,100 million litres per

day (MLD) is being provided under the block water supply scheme in Saurashtra and Kutch, 187 teams have been posted in 14 districts to repair borewells to draw groundwater.

According to the statement, 10,040 villages have been receiving water through the Narmada project network and 4,420 villages get it from other surface sources. "The remaining villages are being covered by tubewells, handpumps and other means. Directions have been issued to dig new borewells where required, the statement added.

Water is being provided by tankers in parts of Devbhoomi Dwarka, Kutch, Bhavnagar, Gir Somnath, Rajkot, Jamnagar, Morbi, Surendranagar and Banaskantha districts, where water is not available because of reasons such as power failure, leaks in pipelines, lack of connectivity of schemes, and the like, the statement added.



SURAT: Amid sanctions on Russia, India's import from the country at war with Ukraine has actually increased in 2022-23 when compared to the previous year.

In 2022, after Russia-Ukraine war had started, the US Treasury Department announced restrictions on the rough mined in Russia. However, India's import of rough from Russia reached \$855.83 million in 2022-23

over \$918 million. Russia plays a key role in global rough supply with around 30% share. It mines small-size diamonds that provide employment to a large number of diamond and jewellery workers compared to those working with big-size diamonds.

Considering these reasons, leading diamond polishing and manufacturing companies are closely

monitoring the developments in Russian roughs. "Russian roughs are less expensive and the main source of employment and material for jewellery," said Vijay Manglikya, regional chairman of Gem and Jewellery Export Promotion Council (GJEPC).

Meanwhile, industry sources claim that diamond units that entirely depend on Russian rough are sourcing it through banks that have payment options in Russia in Indian rupees.

But the biggest supply came through Belgium last year, sources claim.

"Import of rough from UAE and Belgium has dropped and possibly due to that there is a rise in import of rough from Russia during the last financial year. But this year, the situation will be different due to the slowdown," said Vipul Shah, chairman of GJEPC.

5 more arrested in dummy racket case

Rajkot: Five more people were arrested in the dummy candidates racket in Bhavnagar, taking the total number of arrests to 52.

In the last two days ending Friday, police arrested Jaydeep Dhandhaliya (28), Rusht Baraiya (18), Kiran Baraiya (33) and Mansukh Jani (32), and one 17-year-old boy.

Police said that Jani had hired Kiran as a dummy for the multi-purpose health

workshop exam. At present, Jani and Kiran are both farmers in the Dhore and Piparia villages respectively of Bhavnagar.

Of the 52 arrested, 16 are government employees whose assets are under investigation by the ACB. The masterminds Sharad Panot, Prakash alias PK Dave and others used to charge Rs 5 lakh to Rs 10 lakh from those wanting to hire dummy candidates in exams for

government jobs. The racket was thriving right under the nose of education department since 2012.

Meanwhile, Afzal Khan alias Raju, one of the seven arrested in the extortion case related to the racket, was granted bail by a local court. AAP youth wing leader Yuvrajsinh Jadeja is the main accused in the extortion racket. They had allegedly extorted Rs 1 crore from two masterminds.

Doctor attacked by four at govt hospital

Rajkot: A doctor working in the emergency medicine department of Surendranagar's state-run CU Shah Medical College and Hospital was attacked by four persons, including a history-sheeter, on Thursday night.

Dr Shivrajsinh Zala, 33, has lodged a complaint naming Keval Rabari, a history-sheeter, and his three unidentified accomplices.

He told the police that at around 2:30am on Thursday, the four came to his chamber and Rabari sought treatment for his friend. When Dr Zala enquired about the ailment, Rabari and others got enraged

and started abusing him. Dr Zala called the security guards but the accused hurled a wooden block and chair at the doctor. They also flung the BP machine which hit his hand. Following the incident, the hospital authorities held an emergency meeting while the doctors threatened to go on strike if the four were not arrested within 24 hours. The accused were booked under sections of Gujarat Medicare Service Persons and Medicare Institutions (Prevention of Violence and Damage or Loss of Property) Act, besides under relevant sections of IPC.

26-year-old man gets life term till last breath for molesting 3 kids

Rajkot: A POCOS court here has sentenced a 26-year-old man to life imprisonment for molesting three children in September 2020. Judge J D Suthar of the POCOS court convicted Nipal Satyendrakumar Dharmadevram for the offence and sentenced him to life imprisonment till his last breath.

According to the case, a woman residing in the RMC quarters came to know from her two children — a seven-year-old boy and a

six-year-old girl — that the accused had touched their private parts, kissed them inappropriately, and molested them. He had also threatened them not to tell about this anybody.

When the woman discussed the incident with another woman in the neighbourhood, she came to know that the latter's seven-year-old daughter had also been molested by the same person.

To get power connections, two forged documents, now booked

Surat: A complaint of forgery and cheating has been filed against two persons at Lalgate police station of Surat for allegedly forging documents to get electricity connections to 16 flats from Torrent Power. After getting the power connections, the two accused also sold the flats though they did not own the flats.

The police complaint was filed by Ibrahim Nagori against Firuz Kazi and Rafiq Tapali. According to the complaint, Kazi and Tapali created a fake development agreement to get the power connections by faking the signatures of the owners and later sold the flats.

To get power connections, two forged documents, now booked

As the case goes, Nagori had bought a property in Rampura from Kazi in 2012 through a notarised document and sale deed with occupation rights. As Nagori and his wife were occupiers of the property, document and sale

To get power connections, two forged documents, now booked

deed with occupation rights. As Nagori and his wife were occupiers of the property, they later developed the space and built 16 flats there after getting the plan sanctioned from SMC. But as some other SMC permissions and electricity connections were pending, the flats were not being used.

Meanwhile, Kazi and Tapali made a fake development agreement for the property to get electricity connections to these 16 flats. In this agreement, they faked the signature of Nagori's wife Zulekha.

Not only that, they also faked the signature of witness Javantiben Chauhan who does not sign but gives thumb impression.

After getting the electricity connections, Kazi and Tapali sold the flats to other persons who in turn rented out the flats. As the property belonged to Nagori and his wife, police filed an FIR for cheating, forgery and under other appropriate sections of the law.

Amarnath Securities Limited

CIN No. L67120GJ1994PLC023254
Reg. Office - 1/104, Sarthak, Opp. C.T. Centre, B/H Swastik Cross Road, Ahmedabad - 380009
Corporate Office - Office No. 506 & 507, 5th floor, Misses, Sahar Plaza, Andheri Kurla road, Andheri East MUMBAI MH 400059

STATEMENT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER/YEAR ENDED ON MARCH 31, 2023 (₹ in lakhs)

Sr. No.	Particulars	Quarter ended		Year ended	
		31.03.2023 Audited	31.12.2022 Un-audited	31.03.2022 Audited	31.03.2023 Audited
1	Income				
	(a) Income from operations	10.189	10.188	6.432	38.232
	(b) Other income	0.003	-	-	0.211
	Total Income	10.192	10.188	6.432	38.444
2	Expenditure				
	(a) Cost of Materials Consumed	-	-	-	-
	(b) Purchases of Stock-in-Trade (Increase/Decrease in Inventories of Finished Goods & work in process)	-	-	-	-
	(c) Employee benefits expense	1.050	1.050	1.050	4.200
	(d) Finance Cost	1.208	1.063	-	2.941
	(e) Depreciation and amortization	-	-	0.132	-
	(f) Other expenses	4.271	1.312	3.222	10.610
	Total Expenditure	6.529	3.425	4.404	17.751
3	Profit/(Loss) before exceptional items and tax (1-2)	3.663	6.763	2.028	20.693
4	Exceptional items	-	-	-	0.235
5	Profit/(Loss) before tax (3-4)	3.663	6.763	2.028	20.458
6	Tax Expense	-	-	0.520	6.362
	(a) Current Tax	-	-	-	-
	(b) Deferred Tax	-	-	0.007	0.683
7	Net Profit/(Loss) for the period (5-6)	3.663	6.763	1.501	13.414
8	Other Comprehensive Income/Expenses (net of tax) (OCI)				
	(a) Items that will not be reclassified to profit and loss	-	-	-	-
	(b) Items that will be reclassified to profit and loss	-	-	-	-
	Total	-	-	-	-
9	Total Comprehensive Income for the period (7+8)	3.663	6.763	1.501	13.414
10	Paid-up equity share capital (Face Value of ₹ 10/-each)	300.020	300.020	300.020	300.020
11	Reserve excluding revaluation reserves as per balance sheet of previous accounting year	-	-	-	-
12	Earnings Per Share (EPS)				
	(a) Basic and Diluted EPS before extraordinary items for the period, for the year to date and for the previous year (not to be annualized) (in)	0.12	0.23	0.05	0.45
	(b) Basic and Diluted EPS after Extraordinary items for the period for the year to date and for the previous year (not to be annualized) (in)	0.12	0.23	0.05	0.45

BHATIA COMMUNICATIONS & RETAIL (INDIA) LIMITED
CIN: L32109GJ2008PLC053336
Regd. Off: 132, Dr. Ambedkar Shopping Centre, Ring Road, Surat-395002
Website: www.bhatiamobile.com; E-mail: info@bhatiamobile.com; Ph: 0261-2349892

Extract of Audited Financial Result for the Quarter and Year ended 31st March, 2023

Sl. No.	Particulars	Amount in Lakh except EPS				
		Quarter ended 31 st March 2023	Quarter ended 31 st December 2022	Year ended 31 st March 2023	Year ended 31 st March 2022	Year ended 31 st March 2022
1	Total Income from Operations	8236.262	8,878.041	5,895.477	31,348.179	23,347.165
2	Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	384.643	329.126	191.915	1,131.535	707.641
3	Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	384.643	329.126	191.915	1,131.535	707.641
4	Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	285.954	245.843	177.705	848.634	527.264
5	Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income(after tax))	(0.037)	0.745	(0.157)	2.197	2.979
6	Equity Share Capital	1,251.520	1,251.520	1,251.520	1,251.520	1,251.520
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited/Unaudited Balance Sheet of the previous year *	-	-	4,204.398	3,370.055	-
8	Earnings Per Share (Face value of ₹. 10/- each) (for continuing and discontinued operations)					
	1. Basic	0.228	0.196	0.142	0.678	0.421
	2. Diluted	0.228	0.196	0.142	0.678	0.421

Notes:

- The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual Financial Results are available on the websites of the Stock Exchange(s) at www.bseindia.com and the listed entity at www.bhatiamobile.com.
- The above financial results have been reviewed and recommended by the Audit Committee and have been approved and taken on record by the Board of Directors at its meeting held on 29th May, 2023.
- The figures for the quarter ended March 31, 2023 and March 31, 2022 are the balancing figures between audited figures in respect of full financial year and the published year to date figures upto the end of third quarter which was subjected to limited review.

Date: 30.05.2023
Place: Surat

For BHATIA COMMUNICATIONS & RETAIL (INDIA) LIMITED
Sd/-
Sanjeev Harbans Bhatia
Managing Director
DIN: 02063671

SUVIDHAA INFOSERVE LIMITED
Registered Office: Unit No. 02, 20th Floor, CPTI-II Building, Block No. 58, Ring Road, Zone-5, Giti City Gandhinagar, 382255
Corporate Office: 14, Olympia Industrial Estate, Off Mahakali Caves Road, Andheri (East), Mumbai 400093
Tel: + 91 2229232923 | E-mail: ceo@suvidtha.com | Website: www.suvidtha.com

Extract of Consolidated and Standalone Un-audited Financial Results for the Quarter and year ended March 31, 2023

Sr No	Particulars	Quarter ended		Year Ended		Standalone		Year Ended	
		31.03.2023 (Audited)	31.12.2022 (Un-audited)	31.03.2022 (Audited)	31.03.2023 (Audited)	31.03.2023 (Audited)	31.12.2022 (Un-audited)	31.03.2022 (Audited)	31.03.2023 (Audited)
1	Total Income from Operations (net)*	176.79	113.50	145.59	411.00	455.72	171.66	100.35	116.93
2	Net Profit/(Loss) for the period (before Depreciation, Tax, Exceptional and/or Extraordinary items)	46.90	27.98	53.05	121.29	116.70	30.27	24.86	130.99
3	Net Profit/(Loss) for the period before tax (before Exceptional and/or Extraordinary items)	12.37	-6.91	17.13	-17.51	-24.39	52.61	-4.54	-8.12
4	Net Profit/(Loss) for period before tax (after Exceptional and/or Extraordinary items)	12.37	-6.91	19.08	-17.51	-21.70	18.22	-4.54	-8.12
5	Net Profit/(Loss) for period after tax (after Exceptional and/or Extraordinary items)	12.37	-6.91	15.86	-17.51	-24.83	18.22	-4.54	-8.12
6	Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	13.37	-6.91	15.57	-16.51	-25.21	19.22	-4.54	-8.40
7	Paid-up Equity Share Capital (Face Value of ₹. 10/- each)	207.45	207.45	203.29	207.45	207.45	207.45	203.29	207.45
8	Reserve (excluding Revaluation Reserves) as shown in the Audited Balance Sheet of previous year	-	-	498.10	514.56	-	-	1,076.77	1,083.32
9	Earnings Per Share (Face Value of ₹. 10/- each) (for continuing and discontinued operations)	0.06	-0.03	0.08	-0.09	-0.12	0.09	-0.02	-0.08
	1. Basic (Not Annualized)	0.06	-0.03	0.08	-0.09	-0.12	0.09	-0.02	-0.08
	2. Diluted (Not Annualized)	0.06	-0.03	0.08	-0.09	-0.12	0.09	-0.02	-0.08

Notes:

- The above is an extract of the detailed format of the Audited Financial Results (Standalone and Consolidated) for the quarter and year ended March 31, 2023. The same has been filed with the Stock Exchanges under Regulation 47 read with Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full formats are available on the website of the Stock Exchange(s) at www.bseindia.com & www.nseindia.com and the Company's website at <https://www.suvidtha.com/financial-results.html>
- The above financial results have been reviewed and recommended by the Audit Committee and have been approved and taken on record by the Board of Directors at its meeting held on 29th May, 2023.
- The figures for the quarter ended March 31, 2023 and March 31, 2022 are the balancing figures between audited figures in respect of full financial year and the published year to date figures upto the end of third quarter which was subjected to limited review.

Date: May 29, 2023
Place: Mumbai

For and on behalf of Suvidhaa Infoserve Ltd.
Prashant Thakar
Executive Director & CFO
DIN: 03179115

Notes:

- The above Financial Results have been reviewed by Audit Committee and have been approved and taken on record by Board of Directors in their respective meetings held on 30th May, 2023 and are based on Financial Statement audited by Statutory Auditor.
- The above financial results for the quarter and year ended on March 31, 2023 have been prepared in accordance with Indian Accounting Standards (Ind AS) notified under Section 133 of the Companies Act, 2013 and other recognized accounting practices and policies to the extent applicable.
- Figures for the quarter ended 31st March, 2023 and 31st March, 2022 represent the difference between the audited figures in respect of full financial year and published figures of nine months ended 31st December 2022 and 31st December 2021 respectively which were subject to a limited review by the statutory auditors.
- Figures for previous quarters/year have been regrouped/reclassified/rearranged wherever necessary.

For and on behalf of Amarnath Securities Limited
Nareesh Padhir
Director
DIN : 08379067

